

#### PBM POLYTEX LTD.

CIN :L17110GJ1919PLC000495 REGD. OFFICE: OPP. STATION, POST PETLAD – 388450, DIST: ANAND, GUJARAT,

PHONE: 224001, 224003, STORES: 224005, SALES: 224006, FAX (02697) 224009, E-Mail: <a href="mailto:pbmmills@patodiagroup.com">pbmmills@patodiagroup.com</a>

#### **THROUGH BSE.LISTING CENTRE**

Dt.:14.08.2024

To,
The General Manager
M/s. BSE Limited,
Department of Corporate Services,
Floor 25, P. J. Towers,
Dalal Street, Mumbai – 400001

<u>Company Code:</u> <u>BSE Limited, Listing Code – 514087</u>

Sir / Madam,

SUB: SUBMISSION OF COPIES OF NEWSPAPER ADVERTISEMENT FOR THE UNAUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUERTER ENDED 30<sup>TH</sup> JUNE, 2024.

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith copies of the Newspaper advertisement published in both English and Regional Language i.e. Gujarati newspaper, "FINANCIAL EXPRESS" on 14<sup>th</sup> August, 2024, for publishing the Un-audited Standalone and Consolidated Financial Results for the quarter ended 30<sup>th</sup> June, 2024, as approved in the Board Meeting of the Company held on Tuesday, 13<sup>th</sup> August, 2024.

Kindly take note of the same.

Thanking you,

**For PBM Polytex Limited** 

(Gopal Patodia) Managing Director (DIN: 00014247)

**BARODA OFFICE:** 8<sup>TH</sup> FLOOR, "RAMAKRISHNA CHAMBERS", PRODUCTIVITY ROAD, ALKAPURI, BARODA – 390 007. TELEPHONE NO.: 2333587, 2320053, FAX NO. (0265) 2338979

E-Mail: pbm@patodiagroup.com, Website: www.pbmpolytex.com

#### **CONSOLIDATED FINVEST & HOLDINGS LIMITED**

Regd. Office: 19th K.M., Hapur Bulandshahr Road, P.O. Gulaothi, Bulandshahr (U.P.) Head Office: Plot No. 12, Local Shopping Complex, Sector - B -1, Vasant Kunj, New Delhi - 110070

CIN:L33200UP1993PLC05474 Tel. No.: 011 - 40322100 E-mail:cs\_cfhl@jindalgroup.com website: www.consofinvest.com

EXTRACTS OF THE STANDALONE UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE 2024

PARTICULARS	Quarter Ended 30.06.2024 Un-audited	Quarter Ended 30.06.2023 Un-audited	Year Ended 31st March 2024 Audited
Total Income from operations	1775	1,380	5,169
Net Profit for the period (before Exceptional items and tax)	1,759	1,355	5,090
Net Profit for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	1,759	1,355	5,090
Net Profit for the period after Tax (after Exceptional and/or Extraordiniary Items)	2,296	1,034	4,646
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after Tax))	6,091	3,041	6,480
Total Comprehensive Income for the period attributable to owner of the parent	6,091	3,041	6,480
Paid up Equity Share Capital (Face Value of Rs 10/- each)	3233	3,233	3,233
Other Equity (excluding Revaluation Reserve)	-	-	77,583
Earnings Per Share (EPS) (of Rs. 10/- each) on Net Profit (Not annualised)	7.10	3.20	14.37

#### Note:

Place: New Delhi

- 1. Financial Results has been prepared in accordance with The Indian Accounting Standards ("Ind AS") prescribed under section 133 of the Companies Act 2013 read with the relevant rules issued thereunder.
- 2. The above results were reviewed by the Audit Committee and taken on record at the meeting of the Board of Directors at their respective meetings held on 13th August 2024 and limited review of these results has been carried out by the Statutory Auditors of
- 3. The above is an extract of the detailed format of un-audited Financial Results filed with the Stock Exchanges under Regulation  $33\,$  of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the Stock Exchange's websites (www.nseindia.com) and also on the Company's website at www.consofinvest.com.

Date: 13th August 2024 以到可见民

## **ROLEX RINGS LIMITED**

for Consolidated Finvest & Holdings Limited

Managing Director - DIN: 01623575

Sanjiv Kumar Agarwal

Regd. Office: BEHIND GLOWTECH STEEL PRIVATE LIMITED, GONDAL ROAD, KOTHARIA, RAJKOT. Phone: **0281-6699577/6699677** [CIN: L28910GJ2003PLC041991] Email: compliance@rolexrings.com website. www.rolexrings.com

### રોલેક્સ રિંગ્સ લિમિટેડ ની ૨૨મી વાર્ષિક સાધારણ સભાની નોટીસ અને રિમોટ ઈ-વોટીંગ ની માહિતી

આથી નોટીસ આપી જણાવવામાં આવે છે કે રોલેકસ રિંગ્સ લિમિટેડ ની રશ્મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ) ગુરુવાર, ૦૫મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના બપોરે ૧૨.૦૦ વાગ્યે વિડિયો કોન્ફરન્સીંગ (વીસી)/અન્ય ઓડિયો વિઝયુઅલ માધ્યમો (ઓએવીએમ) બ્રારા ૨૨મી એજીએમ ની નોટીસમાં દર્શાવેલ એજેન્ડાઓના વ્યવહારો કરવા માટે, કંપની કાયદા, ૨૦૧૩ની જોગવાઈઓને આધીન, સાધારણ પરિપત્ર નં. ૧૪/૨૦૨૦ તા.એપ્રીલ ૮,૨૦૨૦, પરિપત્ર નં. ૧७/૨૦૨૦ તા.એપ્રીલ ૧૩,૨૦૨૦, પરિપત્ર નં.૨૦/૨૦૨૦, તા.મે ૦૫, ૨૦૨૦, પરિપત્ર નં. ૦૨/૨૦૨૧ તા.જાન્યુઆરી ૩૧,૨૦૨૧, પરિપત્ર નં.૧૯/૨૦૨૧ તા.કિસેમ્બર ૧૪,૨૦૨૧ અને પરિપત્ર નં. ૩/૨૦૨૨ તા. મે ૦૫,૨૦૨૨ અને પરિપત્ર નં. ૧૦/૨૦૨૨ તા. ડીસેમ્બર ૨૮, ૨૦૨૨ કોર્પોરેટ બાબતમાં મંત્રાલય દ્વારા આપવામાં આવેલ પરિપત્રો (''એમસીએ''), સિક્ચોરીટીઝ અને એકસચેન્જ બોર્ડ એફ ઈન્ડિયા પરિપત્ર નં. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 તા. જાન્યુઆરી ૧૫,૨૦૨૧ પરિપત્ર નં. SEBI/HO/CFD/ CMD2/CIR/P/2022/62 તા. મે ૧૩,૨૦૨૨ અને પરિપત્ર નં. SEBI/HO/CFD/POD2/CIR/P/2023/4 તા. ૫ જાન્યુઆરી ૨૦૨૩ અને સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન અને ડિસકલોઝર રિકવાયરમેન્ટ) નિયમો ૨૦૧૫ (''સેબી લીસ્ટીંગ નિયમો''), રાખવામાં આવેલ છે.

રુરમી એજીએમ ની નોટીસ, રિમોટ ઈ-વોટીંગ અને ઈ-વોટીંગ ની પદ્ધતિ અને માહિતી ની સાથે કંપનીના વર્ષ ૨૦૨૩-૨૪ નો વાર્ષિક અહેવાલ તેમજ તા. ૩૧ માર્ચ ૨૦૨૪ ના રોજ પુરા થતા વર્ષના નાણાકિય નિવેદનો, એવા દરેક સભ્યો ને ઈ-મેઈલ તા.૧૩ ઓગષ્ટ ૨૦૨૪ ના રોજ મોકલાવેલ છે, જેમના ઈ-મેઈલ આઈડી કંપની અથવા ડિપોઝીટરી પાસે રજીસ્ટર્ક છે. કંપનીના વર્ષ ૨૦૨૩-૨૪ નો વાર્ષિક અદેવાલ તેમજ એજીએમ ની નોટીસ કંપનીની વેબસાઈટwww.rolexrings.com/Annual-reports/, રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ (''આરટીએ'') લિંક ઈન ટાઈમ ઈન્ડીયા પ્રાઈવેટ લિમિટેડ ની વેબસાઈટ www.linkintime.co.in તેમજ બીએસઈ અને નેશનલ સ્ટોક એકસચેન્જ ઓફ ઈન્ડિયા ની વેબસાઈટ www.bseindia.com અને www.nseindia.com પર પણ ઉપલબ્ધ રહેશે.

કંપની આ ૨૨ મી એજીએમ ની નોટીસમાં જણાવેલ તમામ ઠરાવો પર ઈલેકટ્રોનિક રીતે મત આપવા માટે સભ્યોને ઈ-વોટીંગ સવલત આપતા આનંદ અનુભવે છે. ઈ-વોટીંગ ની સવલત એજીએમ માં પણ ઉપલબ્ધ રહેશે. દરેક સભ્યોને જણાવવામાં આવે છે કે :-

- ૧. ૨૨ મી એજીએમની નોટીસમાં વીસી / ઓએવીએમ દ્વારા ભાગ લેવા માટેની માફિતી અને ઈ-વોટીંગની પ્રક્રિયાની સાથે જે સભ્યો પાસે ફીઝીકલ શેર हોય અથવા જેમના ઈ-મેઈલ એડ્રેસ રજીસ્ટર્ડ ના હોય એમને કંઈ રીતે ઈ-વોટીંગ કરવુ એની વિગત આપેલ છે.
- ર. જે સભ્યોનું નામ કટ ઓફ તારીખે રજીસ્ટર ઓફ મેમ્બર અથવા રજીસ્ટર ઓફ બેનીફિસીચલ ઓનર જે ડિપોઝીટરીસ દ્વારા સાચવવામાં આવે છે, એવા જ સભ્યોને રિમોટ ઈ-વોટીંગ સવલત અથવા મત આપવાની સુવિધા એજીએમ સંદર્ભે મળશે.
- 3. રીમોટ ઈ-વોટીંગનો સમય સોમવાર, ર સપ્ટેમ્બર, ૨૦૨૪ ના સવારે ૦૯:૦૦ કલાકેથી શરૂ થશે અને બુધવાર તા.૦૪ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ સાંજે ૦૫:૦૦ કલાક પછી બંધ કરવામાં આવશે અને એકવાર મત આપ્યા બાદ કોઈપણ પ્રકારના ફેરફાર કરી શકાશે નહિં.
- ૪. જે સભ્યોએ રીમોટ ઈ-વોટીંગ સુવિધા દ્વારા મત એજીએમ પહેલા આપેલ હોય, તે બેઠકમાં વીસી દ્વારા ભાગ લઈ શકશે, પણ તે ફરી પાછા મત આપી શકશે નહીં, જે સભ્યોએ
- રીમોટ ઈ-વોટીંગ દ્વારા મત નથી આપેલ અને જે એજીએમ માં હાજર હોય તો તેઓ ઈ-વોટીંગ સવિધા મારકતે મત આપી શકશે. ૫. જે સભ્યોના શેર ડીમટીરીચઅલાઈઝડ સ્વરૂપે હોય પણ જેમણે પોતાના ઈ-મેઈલ એફેસ રજીસ્ટર નથી કર્યા તેમણે વિનંતી છે કે તેઓ પોતાના ડિપોઝીટરી પાર્ટીસીપન્ટ પાસે રજીસ્ટર કરાવી લઈ અને જે સભ્યોના શેર ફિઝિકલ સ્વરૂપે હોય તેઓ સ્કેન દસ્તાવેજોની નકલ ની સાથે રિકવેસ્ટ લેટર જેમા ફોલીયો નં., પુરૂ સરનામુ, ઈ-મેઈલ એડ્રેસ અને પાન કાર્ડની સ્વપ્રમાણીત નકલ અને અન્ય કોઈ દસ્તાવેજ (લાઈસન્સ, પાસપોર્ટ, બેન્ક સ્ટેટમેન્ટ, આધારકાર્ડ) કંપની ને ઈ-મેઈલમાં Compliance@rolexrings.com અથવા લિંક ઈન ટાઈમ ઈન્ડિયા ને rnt.helpdesk@linkintime.co.in પર મોકલી દેવાનું રહેશે.

3. ઇ-વાદિગાળ લગભા પ્રસ્તા નાટ .	
વ્યકિતગત શેરધારકો જે શેર્સ એનએસડિએલ (NSDL)કિ-મેટ સ્વરૂપે મેળવેલ છે	જે સભ્યોને કોઈ ટેકનીકલ મુદાને કારણે લોગ ઈન ના થઈ શકે તો તેઓ એનએસિકએલ (NSDL) વિભાગને evoting@nsdl.co.in પર અથવા નિઃશુલ્ક નં. ૦૨૨-૪૮૮૬७૦૦૦/૨૪૯૯७૦૦૦ ઉપર વિનંતી કરી શકે છે.
વ્યકિતગત શેરધારકો જે શેર્સ સીડિએસએલ	જે સભ્યોને કોઈ ટેકનીકલ મુદાને કારણે લોગ ઈનના ના થઈ શકે તો તેઓ સીડિએસએલ (CDSL) ના મદદ વિભાગને
(CDSL) ડિ-મેટ સ્વરૂપે મેળવેલ છે	evoting@cdslindia.com પર અથવા નિઃશુલ્ક નં. ૧૮૦૦ ૨૨ ૫૫ ૩૩ ઉપર વિનંતી કરી શકે છે.
સંસ્થાકિય શેરધારકો/વ્યકિતગત શેર ધારકો	શેરધારકો જેને કોઈપણ પ્રકારના ટેકનિકલ મુદાના લીધે લોગ ઈન ના થઇ શકે તો તે લિંક ઈન ટાઈમ ના ઈન્સ્ટાવોટ મદદ
જેના પાસે ફીઝીકલ સ્વરૂપે શેર્સ છે.	વિભાગમાં enotices@linkintime.co.in પર અથવા ૦૨૨-૪૯૧૮૬૦૦૦ ઉપર વિનંતી કરી શકે છે.

તારીખ : ૧૩ ઓગષ્ટ. ૨૦૨૪ સ્થળ : રાજકોટ

રોલેક્સ રિંગ્સ લિમિટેડ (હાર્દિક ધીમંતભાઈ ગાંધી) કંપની સચિવ અને કમ્પલાયન્સ ઓફીસર કેનરા બેંક Canara Bank 📣

અધિકૃત અધિકારી, કેનરા બેંક

સુધારો

આ તારીખ ૧૦.૦૮.૨૦૨૪ ના રોજ વર્તમાનપત્રમાં પ્રકાશિત ઇ-હરાજી વેચાણ નોટીસના સંદર્ભમાં છે, જે તારીખ ૨૮.૦૮.૨૦૨૪ ના રોજ થવાનું નિર્ધારીત છે, એ સ્પષ્ટતા કરવામાં આવે છે કે અનુ નં. ૧ અને ૨ હેઠળ શ્રી રોમી રાજેન્દ્ર મોરજરીયા અને શ્રીમતી અમી હિનાબેન ગણાત્રાની મિલકતોની વિગતોમાં કબજાનો પ્રકાર સાંકેતિક કબજાને બદલે પ્રત્યક્ષ કબજા તરીકે વાંચવા વિનંતી. ઇ-હરાજીની અન્ય તમામ વિગતો સમાન રહેશે.



સ્થળ : ગાંધીનગર

## **INGERSOLL-RAND (INDIA) LIMITED**

Regd. Office: First Floor, Subramanya Arcade, No. 12/1. Bannerghatta Road, Bengaluru – 560 029.
CIN: L05190KA1921PLC036321
Telephone: +91-80-46855100 Fax: +91-80-41694399 Website: www.irco.com

#### STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2024

(Rupees in Lakhs, except per equity share data)

Particulars	Quarter Ended June 30, 2024	Year Ended March 31, 2024	Corresponding Quarter Ended June 30, 2023
	(Unaudited)	(Audited)	(Unaudited)
Total income	32,291	1,24,120	31,020
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/ or Extraordinary items)	8,329	29,804	7,233
Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/ or Extraordinary items)	8,329	29,804	7,233
Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/ or Extraordinary items)	6,186	22,239	5,373
Total Comprehensive Income for the period [comprising profit / (loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	6,209	22,333	5,375
Equity Share Capital	3,157	3,157	3,157
Earnings Per Share (of Rs.10/- each)			
Basic:	19.60	70.45	17.02
Diluted:	19.60	70.45	17.02

(1) The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results are available on the Stock Exchange websites www.nseindia.com and www.bseindia.com and on the Company's website (www.irco.com).

For and on behalf of the Board of Directors

Place: Ahmedabad Date : August 12, 2024

P. R. Shubhakar Chief Financial Officer & Company Secretary Whole-time Director

### **PBM POLYTEX LIMITED**

(CIN: L17110GJ1919PLC000495) Registered Office: Opp. Railway Station, Petlad, Dist: Anand, Gujarat - 388450

Phone: 224001, 224003 Stores: 224005 Sales: 224006 Email: pbmmills@patodiagroup.com website: www.pbmpolytex.com Extract of Unaudited Financial Results for the Quarter ended 30th June, 2024

SL Particulars STANDALONE CONSOLIDATED Quarter Ended Year Ended Year Ended Quarter Ended 30/6/2024 31/3/2024 30/6/2023 31/3/2024 30/6/2024 31/3/2024 30/6/2023 31/3/2024 (Unaudited) (Audited) (Unaudited) (Audited) Unaudited) (Audited) (Unaudited) (Audited) Total income from operations 4.168.13 5,395.73 4.543.94 19,600,42 4.161.65 5.374.75 4.524.08 19.579.44 (838.91 Net profit / (Loss) for the period (144.70)81.7 (302.89)(151.18 34.68 (322.77)(859.89) (before tax and exceptional and/or Extraordinary items) Net profit / (Loss) for the period (144.70) 81.77 (302.89) (838.91) (151.18 34.68 (322.77 (859.89) before tax (after exceptional and/o Extraordinary items) 63.56 (629.63 (645.33) Net profit / (Loss) for the period (102.78)(223.14)(107.63) 28.32 (238.02 after tax (after exceptional and/or Extraordinary items (76.45) 96.00 (235.67 (593.74) (81.30) (250.55 (609.44) Total comprehensive income for 60.75 the period [comprising profit / Loss for the period (after tax) and Other comprehensive income (after tax)] 687.90 687.90 687.90 687.90 687.90 687.90 Paid-up Equity Share capital 687.90 687.90 Reserve (excluding Revaluation 11,124.44 Reserve) as shown in audited balance sheet Earnings per equity share (of Rs.10 each) (for continuing and discontinued operations) b) Diluted (1.49) 0.92 (3.24)

Notes: [1] The above financial results have been reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors of the Company in thei espective meetings held on August 13, 2024. The limited review as required under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements Regulations, 2015 has been completed by the statutory auditors of the Company and the related report is being submitted to the concerned stock exchanges [2] The financial results for the Quarter ended June 30, 2024 have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules 015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognised accounting practices and policies to the extent applicable [3] The above is an extract of the detailed format of Financial Results for the Quarter ended June 30, 2024, filed with the Stock Exchanges, under the Regulatio 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results is available on the Stock Exchang website www.bseindia.com and on the Company's website www.pbmpolytex.com

For and on behalf of Board of Director **PBM Polytex Limited** Gopal Patodia Managing Director DIN: 00014247

(Rs. In Lakhs except EPS

Place: Vadodara Date: August 13, 2024

dl.: 30.06.2028

## MANGALYA SOFT-TECH LIMITED

CIN- L32100GJ1992PLC017564

Regd. Office- Shop-304, "Sankalp Square-2", Nr. Delux Appartment, Nr. Kalgi Char Rasta, Jalaram Temple, Paldi, Ahmedabad-380006 E-mail: kushal@ratnakarsecurities.com, Contact no. 079-49005200

## **EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS**

	EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS						
	FOR THE QUARTER ENDED ON 30th JUNE	, 2024					
		(R	s. In lakhs E	xcept EPS)			
		Quarte	r ended	Year ended			
Sr. No.	Particulars		30.06.2023 Unaudited				
1	Total Income From Operations (net)	0.00	0.00	0.00			
2	Net Profit/(Loss) for ordinary activities (before Tax, Exceptional and/or Extraordinary Items)	(0.16)	(0.53)	(10.64)			
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(0.16)	(0.53)	(10.64)			
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(0.16)	(0.53)	(10.64)			
5	Total Comprehensive Income for the Period {Comprising Profit/(Loss) for the period (After Tax) and Other Comprehensive Income (After Tax)}	(0.16)	(0.53)	(10.64)			
6	Equity Share Capital.(face value of Rs.10 each)	52.00	1000.00	52.00			
7	Reserves (excluding Revaluaton Reserve) as shown in balance Sheet of previous year	-	-	(98.86)			
8	Earning Per Share (of Rs.10 /- each) (For continuing and discontinued operations)						
	Basic	(0.03)	(0.01)	(2.05)			
	Diluted	(0.03)	(0.01)	(2.05)			

#### Diluted Note

1. The above is an extract of the detailed audited financial results ("Results") filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure requirements) Regulations, 2015. The full Financial Results are available on website of Stock Exchange (i.e. www.bseindia.com) and website of the Company (i.e www.mangalvasofttech.in)

2. The above results were reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors at their meeting held on August 13, 2024. For, Mangalya Soft-Tech Limited

> Ajay Jayantilal Shah **Chairman & Managing Director**

Date: 13/08/2024 Place: Ahmedabad DIN: 00023582

## यूनियन बैंक 🕠 Union Bank

धनदक्षी मार्डेट शाजा, पो.जो. नं. १०७०, રેલવેપુરા, અમદાવાદ-3૮૦૦૦૨

મેઇલ: ubin0531260@unionbankofindia.bank

ક્લમ ૧૩(૨) હેઠળ ડિમાન્ડ નોટીસ

ਮੁਰਿश्री ૧. દેવાદાર/રો શ્રી મુકેશ મનુભાઈ સુથાર

ઈ-૪૦૪,૪થો માળ,૨ામોલ રેસીડેન્સી,૨ામોલ,વસ્ત્રાલ,અમદાવાદ-૩૮૨૪૧૫

માનનીય સાહેબ/મેડમશ્રી .

તરક તમારું ધ્યાન દોરવામાં આવે છે.

सिड्योरिटाएग्रेशन એन्ड रिडन्स्ट्रड्शन ओइ इाएनान्शियल એसेट्स એन्ड એन्ફोर्समेन्ट ओई सिड्योरिटी एन्टरेस्ट એક્ટ, ૨૦૦૨ની કલમ ૧૩ (૩) સાથે વંચાતી કલમ ૧૩ (૨) હેઠળની નોટિસ .

તમે દેવાદાર નં.૧ એ આથી અમારી **ધનલક્ષ્મી માર્કેટ શાખામાંથી** ક્રેડીટ સગવડતા મેળવી હતી અને અને તેની બાકી / હપ્તા વ્યાજ ની ચુકવાણી કરવામાં/એકાઉન્ટને સંતોષકારક રીતે ચલાવવામાં નિષ્ફળ ગયા છો અને જેથી આવકની ઓળખ અને પ્રુડેન્શિયલ એકાઉન્ટિંગ અંગેની આરબીઆઈ માર્ગદર્શિકાના સંદર્ભમાં ધોરણો, તમારા ખાતા/ઓ ને **૩૦.૦૪.૨૦૨૪** ના રોજ ું નોન-પર્ફોર્મિંગ એસેટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. **૨૨.૦७.૨૦૨૪ ના રોજ રૂા. ૧૦,૦૩,૫૧૧.૪૧ (રૂપિયા દસ લાખ ત્રણ હજાર પાનસો અગિયાર અને એકતાલીસ પૈસા પુરા)** તમારા ખાતા/માં બાકી છે.

ઉપરોક્ત ખાતા/ઓ ના સંબંધમાં તમારા નંબર ૧ તરફથી બેંકને બાકી રકમની વિગતો નીચે મુજબ છે:

					•	
સુવિધાનો પ્રકાર	લીમીટ	૩૦.૦૪.૨૦૨૪ના રોજ બાકી સ્ક્રમ	બિન લાગુ વ્યાજ 30.05.૨0૨૪ સુધી	પેનલ વ્યાજ (સરળ)	બેંક હારા થચેલ ખર્ચા/ ચાર્જીસ	કુલ બાકી કુલ માકી
હોમ લોન	e,40,000.00	૧૦,૦૩,૫૧૧.૪૧	२५,४१५.००	૫૨૮.૩૨	0.00	१०,३०,४५५.७३
કુલ બાકી						٩٥,3٥,४૫૫.७3

जाडी नाशा नी युडवशी सुरक्षित डरवा अथवा जेंड ना जाडी नाशा नी युडवशी सुरक्षित डरवा माटे, **श्री मुडेशलार्ध मनुलार्ध सुथारे ૩૧.૧૦.૨૦૧૫ ના રોજ** દસ્તાવેજો બનાવ્યા અને **૦૩.૧૧.૨૦૧૫ ના રોજ** મોર્ગેજ દ્વારા સુરક્ષા વ્યાજ ઉભું કર્યું.

## ગીરો સ્થાવર મિલકતનું વર્ણન નીચે મુજબ છે.

ફ્લેટ નં. ઇ/૪૦૪, ચોથો માળ અંદાજે ૬૯.૩૯ ચોરસ મીટર સુપર બિલ્ટ અપ એરિયા બાંધકામ અને અવિભાજિત જમીન રામોલ રેસિડેન્સીમાં ૨૧.૭૯ ચોરસ મીટર જમીન, ટી.પી. સ્કીમ નં.૧૧૫, એફ પી નં.૩૭/૫, સર્વે નં.૧૬૯/૫, મોજે રામોલ તાલુકો વસ્ત્રાલ, જિલ્લો અને પેટા જિલ્લો અમદાવાદ -૧૧ (અસલાલી) ખાતે સ્થિત છે. **ઉત્તરઃ** ખુલ્લી જમીન, **દક્ષિણઃ** ફ્લેટ નંબર ઇ/૪૦૧ . **પર્વઃ** ક્લેટ નંબર ઇ/૪૦૫ . **પશ્ચિમઃ** ક્લેટ નંબર ઇ/૪૦૩ .

જેથી તમોને આથી સિક્ચોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચ્રરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ની કલમ ૧૩(૨)ની શરતો મુજબ **રૂા. ૧૦,૩૦,૪૫૫.७૩ (રૂપિયા દસ લાખ ત્રીસ હજાર ચારસો પંચાવન અને તોત્તેર પૈસા પુરા)** તમારા દ્વારા હાથ ધરેલા લોન દરતાવેજ ના નિયમો અને શરતો મુજબ કરારી દરે આગામી વ્યાજ અને ચાર્જાસ સહીત તેમજ અન્ય બાકી આ નોટીસ મળ્યાની તારીખ થી ૬૦ દીવસમાં ચૂકવી આપવા, તેમા નિષ્ફળ જશો તો કાયદા હેઠળ આપવામાં આવેલ તમામ હક્કો સહીત ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અધિનિયમની કલમ ૧૩ (૧૩) મુજબ, આ નોટિસ મળવા પર તમને બેંકની સંમતિ વિના ઉપરોક્ત સિક્યોરિટીઝનો નિકાલ કરવા અથવા તેની સાથે વ્યવહાર કરવાથી સંયમિત/પ્રતિબંધિત કરવામાં આવે છે. સુરક્ષિત સંપત્તિઓને છોડાવવા માટે ઉપલબ્ધ સમચના સંદર્ભમાં સરફેસી કાયદા ની કલમ ૧૩ ની પેટા-કલમ (૮) ની જોગવાઈઓ

અધિકૃત અધિકારી, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા



Place: Kolkata

Date: 13.08.2024

## **RDB RASAYANS LIMITED**

CIN-L36999WB1995PLC074860 Read. Office: Bikaner Building, 8/1, Lal Bazar Street R.Ño- 09 Kolkata-700001, Ph No (033) 44500500. Fax No 91-33-2242 0588

E-mail: info@rdbindia.com, Website: www.rdbgroup.in EXTRACT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR

				(175.	In Lakhs)
SI. No	Particulars ,	Quarter ended June 30 2024	Quarter ended March 31 2024	Quarter ended June 30 2023	Year ended March 31 2024
		Unaudited	Audited	Unaudited	Audited
1	Total Income from Operations (Net)	6,684.88	3,108.41	2,947.52	12,037.8 <sup>-</sup>
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	999.80	754.97	889.37	3,225.17
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and / or Extraordinary items)	999.80	754.97	889.37	3,225.17
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	732.53	570.11	665.40	2,423.1
	Total Comprehensive Income /(Loss) for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	732.53	561.96	665.40	2,414.9
6	Equity Share Capital (Face Value of Rs.10/- each)	1,771.48	1,771.48	1,771.48	1,771.48
7	Reserves(excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)				16,876.73
8	Earnings Per Share (of Rs. 10/- each) Basic:	4.14	3.22	3.76	13.6
	Diluted:	4.14	3.22	3.76	13.68

The above is an extract of the detailed format of Quarterly un-audited Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/ Annual Financial Results are available on the website of BSE Limited at www.bseindia.com and on the Company's website at www.rdbgroup.in

The above unaudited results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 13th August, 2024.

For RDB RASAYANS LIMITED

Managing Director Shanti Lal Baid DIN: 00056776 46

Place: Mumbai

Date: 12.08.2024

Place: Mumbai

Place: Mumbai

Standalone (in lakhs)

Quarter

Ended

Quarter

Ended

# **VELOX INDUSTRIES LIMITED**

CIN: L52242MH1983PLC029364

Regd. Off.: 902 Filix Commercial Complex, opp Asian Paints L.B.S. Marg, Bhandup Mumbai 400078 Ph.: +91 2262536600, 9082267347 Email: veloxindustriesItd@gmail.com Website: veloxindustriesItd.in

EXTRACT OF THE STANDALONE UNAUDITED FINANCIAL RESULTS

					(Rs. In Lacs)
Sr. No.	Particulars	Quarter ended 30.06.2024 (Unaudited)	Quarter ended 31.03.2024 (Audited)	Quarter ended 30.06.2023 (Audited)	Year ended 31.03.2024 (Audited)
1	Total income from operations	0.00	25.00	0.00	25.00
2	Net Profit / (Loss)for the period(before Tax, Exceptional and/or Extraordinary Items)	3,72	32,67	3.44	17.95
3	Net Profit / (Loss)for the period before Tax(after Exceptional and/or Extraordinary Items)	3,72	32,67	-3.44	17.95
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	2.72	32.68	-3.43	17.94
5	Equity Share Capital	797.40	797.40	797.40	797.40
6	Earnings Per Share (for continuing and discontinued operations)				
	Basic :	0.03	0.41	-0.04	0.23
	Diluted:	0.03	0.41	-0.04	0.23

? The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website i.e. www.bseindia.com and Company website i.e. www.veloxindustriestd.in For and on behalf of the Board of Directors of

1. The above results have been reviewed by the audit committee and approved by the Board of directors at the meeting held on 12:08.2024

Velox Industries Limited Debashis Mukherjee

Managing Director and Chairman

DIN: 00537728

**AADI INDUSTRIES LIMITED** 

Email Id: aadi.industries@hotmail.com Phone No: 9869441118

Regd Off.: 421, 4th Floor, Kailash Plaza, Near R-Odeon Mall, Ghatkopar (East), Mumbai-400077 CIN: L25203MH1994PLC206053

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS

FOR THE QUARTER ENDED JUNE 30, 2024

	ES MINIOR	C	on	Year ended on	
S. No.	Particulars	June 30, 2024 (Unaudited)	March 31, 2024 (Unaudited)	June 30, 2023 (Unaudited)	March 31, 2024 (Audited)
1,	Total Income from operations	1.58	11.84	0.00	11.84
2.	Net Profit/ Loss for the period before Tax, Exceptional and/or Extraordinary Items	(2.72)	7.87	(8.51)	(9.18)
3	Net profit/(Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	(2.72)	7.87	(8.51)	(9.18)
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(2.72)	7.87	(8.51)	(9.18)
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(2.72)	7.87	(8.51)	(9.18)
6	Equity Share Capital	1000	1000	1000	1000
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	a	36		(1669.18)
8	Earnings Per Share (of Rs 10/- each) (for continuing and discounted operations)  1. Basic: 2. Diluted:	(0.03) (0.03)	(0.08) (0.08)	(0.09) (0.09)	(0.09) (0.09)

The above is an extract of the detailed format of Standalone Unaudited Financial Results for the guarter ended as on June 30, 2024, filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly Financial Results are available on the websites of the Stock Exchange i.e. http://www.bseindia.com and on the website of the Company at www.aadiindustries.co

> AADI INDUSTRIES LIMITED Rushabh Shah

Date: 13/08/2024

THE KEY DATA RELATING TO STANDALONE

Particulars

Total income from operations

Extraordinary items)

Extraordinary items)

Extraordinary items)

balance sheet

a) Basic

b) Diluted

Net profit / (Loss) for the period

Net profit / (Loss) for the period

Net profit / (Loss) for the period

after tax (after exceptional and/or

Total comprehensive income for

the period [comprising profit / Loss]

for the period (after tax) and Other

comprehensive income (after tax))

Paid-up Equity Share capital

Reserve (excluding Revaluation

(of Rs.10 each) (for continuing and

Reserve) as shown in audited

Earnings per equity share

discontinued operations)

(before tax and exceptional and/or

before tax (after exceptional and/or

No.

Managing Director (DIN: 01944390)

## **NITCO**

Registered office: 3/A, Recondo Compound, Sudam Kalu Ahire Marg, Glaxo, Worli Colony, Mumbai, Maharashtra, India, 400 030 Tel No.: 022 25772800/25772790, email: investorgrievances@nitco.in, Website: www.nitco.in, CIN: L26920MH1966PLC016547

EXTRACT OF STATEMENT OF CONSOLIDATED FINANCIAL RESULT FOR THE

	AND SO STEPPEN CHEROCOCKI CONTROL CONT	(Rs	. In Lakhs u	niess otherv	vise stated)
Sr.		Thr	ee Months Er	nded	Year ended
No.	Particulars	30.06.2024 (Unaudited)	31,03,2024 (Audited) (Refer Note no.12)	30.06.2023 (Unaudited)	31.03.2024 (Audited)
1	Total Income	7,138.35	7,254.31	9,414.39	33,008.28
2	Net Profit / (Loss) for the period before tax	(4,352.00)	(5,346.64)	(3,243.80)	(16,269.88)
3	Net Profit / (Loss) for the period after tax	(4,352.00)	(5,341.06)	(3,276.69)	(16,297.19)
4	Total Comprehensive Income (after tax)	(4,356.24)	(5,314.59)	(3,289.33)	(16,288.66)
5	Paid-up equity share capital (Face Value Rs. 10 per share)	7,185.90	7,185.90	7,185.90	7,185,90
6	Reserves (excluding Revaluation Reserve) as shown in the last balance sheet of the previous year	-	-		(58,402.56)
7	Earnings per share (of Rs. 10/- each) (not annualized):				- Statement development
(a)	Basic	(6.06)	(7.43)	(4.56)	(22.68)
(b)	Diluted	(6.06)	(7.43)	(4.56)	(22.68)

Sr.	1	Thr	ee Months Er	ded	Year ended
No.	Particulars	30.06.2024 (Unaudited)	31.03.2024 (Audited) (Refer Note no.12)	30.06.2023 (Unaudited)	31.03.2024 (Audited)
1	Total Income	7,047.52	7,191.36	9,361.25	32,782.58
2	Net Profit / (Loss) for the period before tax	(4,351.90)	(5,315.22)	(3,243.36)	(15,625.66)
3	Net Profit / (Loss) for the period after tax	(4,351.90)	(5,315,22)	(3,276.25)	(15,658.55)
4	Total Comprehensive Income (after tax)	(4,356.14)	(5,288.75)	(3,288.89)	(15,650.02)
Note	es:				

The above financial results were reviewed by the audit committee and thereafter taken on record by the Board of Directors at their Meeting held on 13th August 2024. The company's statutory auditors have conducted Limited Review of the above

financial results for the quarter ended June, 2024. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation

33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financia Results is available on the Stock Exchange websites (www.bseindia.com and www.nseindia.com) and Company's website (www.nitco.in). For Nitco Limited

Vivek Talwar Date: 13th August 2024 Chairman & Managing Director

30/6/2024

4,168.13

(144.70)

(144.70)

(102.78)

(76.45)

687.90

(1.49)

(1.49)

(Unaudited)

(CIN: L17110GJ1919PLC000495) Registered Office: Opp. Railway Station, Petlad, Dist: Anand, Gujarat - 388450. Phone: 224001, 224003 Stores: 224005 Sales: 224006 Email: pbmmills@patodiagroup.com website: www.pbmpolytex.com Extract of Unaudited Financial Results for the Quarter ended 30th June, 2024

30/6/2023

4,543.94

(302.89)

(302.89)

(223.14)

(235.67)

687.90

(3.24)

(3.24)

Notes: [1] The above financial results have been reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors of the Company in their

respective meetings held on August 13, 2024. The limited review as required under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements)

Regulations, 2015 has been completed by the statutory auditors of the Company and the related report is being submitted to the concerned stock exchanges.

[2] The financial results for the Quarter ended June 30, 2024 have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules,

2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognised accounting practices and policies to the extent applicable.

[3] The above is an extract of the detailed format of Financial Results for the Quarter ended June 30, 2024, filed with the Stock Exchanges, under the Regulation

33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results is available on the Stock Exchange

(Unaudited)

Year Ended

31/3/2024

19,600.42

(838.91)

(838.91)

(629.63)

(593.74)

687.90

(9.15)

(9.15)

11,358.27

(Audited) (Unaudited)

STANDALONE

Quarter Ended

31/3/2024

(Audited)

5,395.73

81.77

81.77

63,56

96.00

687.90

0.92

0.92

PBM POLYTEX LIMITED

## NIBE ORDNANCE AND MARITIME LIMITED

(Formerly Anshuni Commercilas Limited) CIN- L25200MH1984PLC034879

Reg Office Address: 202, C-Wing, Windfall, Sahar Plaza Complex, J B Nagar, Marol, M. V. Road, Andheri (East), Mumbai - 400059 Tele No.: 022-6209499/022-46195848, Email ID ; anshunicommercialsItd@gmail.com, website : www.anshuni.com STATEMENT UNAUDITED FINANCIAL RESULTS (STANDALONE AND CONSOLIDATED) FOR THE QUARTER ENDED JUNE 30,2024 (7 in Lakhs, except for EPS)

The state of the s	Standalone				Consolidated				
	Quarter Ended			Year ended		Year ended			
	30-06-2024 UNAUDITED	31-03-2024 AUDITED	30-06-2023 UNAUDITED	31-03-2024 AUDITED	30-06-2024 UNAUDITED	31-03-2024 AUDITED	30-06-2023 UNAUDITED	31-03-2024 AUDITED	
Total Income from Operations	16.07	1.00		1.00	16.07	1.00		1.00	
Profit(-Loss) before tax for the period	-4.04	-8.59	-8.11	-19.92	-11.60	-8.59	-8.11	-19.92	
Net Prolit(-Loss) for the period	-4.05	-8.59	-8.10	-19.91	-11.62	-8.59	-8.10	-19.91	
Total Comprehensive Income for the period	-4.05	-8.59	-8.10	-19.91	-9.80	-8.59	-8.10	-19.91	
Paid-up equity share capital (Face Value of Rs.10/- each)	120.00	120.00	120.00	120.00	120.00	120.00	120.00	120.00	
Basic and diluted EPS	-0.34	-0.72	-0.68	+1.66	-0.82	-0.72	-0.68	-1.66	

The above Un-audited Financial Results for the quarter ended June 30, 2024 were reviewed by the Audit Committee and then approved by the Board of Directors at their respective meetings held on August 12, 2023

The above is an extract of the detailed format of Financial Results filled with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the above Financial Results are available on the websites of the Stock Exchange(s) i.e www. bseindia.com and of the Company at www.www.anshuni.com. For and on behalf of the Board of Directors Nibe Ordnance and Maritime Limited

Mahesh Panwar Place : Mumbai Whole-time Director Date: August 12 2024 DIN: 06702073

#### SHRADDHA PRIME PROJECTS LIMITED CIN: L70100MH1993PLC394793

Regd. Office: A-309, Kanara Business Centre Premises CS Ltd., Link Road, Laxmi Nagar, Ghatkopar East, Mumbai-400075 | TEL: (91) 22 216 46000 Website: www.shraddhaprimeprojects.in | Email: shraddhaprimeprojects@gmail.com

Extract of Consolidated Unaudited Financial Results for the Quarter ended 30th June, 2024 (Rs in Lakhs except EPS)

S. No.	EMACES AND ALCONOMICS	Q	Year Ended		
	PARTICULARS	30-Jun-24 (Unaudited)	31-Mar-24 (Audited)	30-Jun-23 (Unaudited)	31-Mar-24 (Audited)
1	Total Income From Operations	2,607.26	3,068.42	286.41	8,381.32
2	Net Profit/Loss for the period (Before Tax,				
	Exceptional and/or Extraordinary Items)	202.18	696.03	88.38	1,064.27
3	Net Profit/Loss for the period (Before Tax,	200000000	500,40000000	2550000	All Descourse
	After Exceptional and/or Extraordinary Items)	202,18	696.03	88.38	1,064.27
4	Net Profit/Loss for the period (After Tax,	21/2/2007	XXXXXXXXXXXXXX	5767566	
13.7	After Exceptional and/or Extraordinary Items)	155.24	(667.46)	57.90	656.48
5	Total Comprehensive Income for the period		190 60		
	(Comprising of Profit for the period [After Tax] and	CINGERMAN	20021400000	83,547,7553	97000000
	Other Comprehensive Income [After Tax])	155.96	(677.65)	57.90	646.29
6	Equity Share Capital		93 AS		
	(Face Value Rs. 10/- per share)	2,020.05	2,020.05	455,48	2,020.05
7	Reserves (excluding Revaluation Reserve)		*		3,262.46
8	Earnings Per Share (EPS)				
	a) Earning Per Share Basic (in Rs.) (* Not Annualised)	0,77	(3.35)	1.27	4.35
	b) Earning Per Share Dlluted (in Rs.) (* Not Annualised)	0.77	(3.35)	1,27	4.35

Additional information on Unaudited Standalone Financial Results for the Quarter ended 30th June, 2024.

(Rs. in Lakhs except EPS)

S. No.	PARTICULARS	Q	Year Ended		
		The second secon	31-Mar-24 (Audited)	30-Jun-23 (Unaudited)	CONTRACTOR SECTIONS
a	Total Income from Operations	2,204.98	1,716.82		4,327.86
b	Profit Before Tax	291.40	(161.86)	(9.28)	769.64
C	Profit After Tax	158.14	(100.36)	(9.28)	653.36
d	Total Comprehensive Income for the period	158.86	(110.55)	(9.28)	643.17

subsidiaries being partnership and limited liability partnership firms (together referred as ""the Group"") have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 12 August 2024.

As the Board of Directors monitors the business activity as single segment viz. real estate development and related construction activities, the consolidated financial results are reflective of the disclosure requirements of Ind AS 108 - Operating Segments. Further, the operations of the Group is domiciled in India and therfore there are no reportable geographical segment.

respect of full financial year upto 31 March 2024 and the unaudited published year-to-date figures upto 31 December 2023, being the date of the end of the third quarter of the previous financial year which were subject

of The Income Tax Act, 1961 at various premises of the Group during the month of May 2024. The Group has provided all the necessary support and cooperation to the Income-tax officials during the search and provided all the necessary information including documents and data sought by the Department including repiles towards the summons received under section 131(1A) of The Income Tax Act, 1961. As on date of issuance of these financial results, the Group has not received any further written communiction from the department regarding the outcome of the search, therefore, the consequent impact on the financial results for the three months ended 30 June 2024, if any, is not ascertainable. While the uncertainity exist regarding the outcomes of the proceedings by the Department, the Group after considering all available records and facts known to it, has

The previous period figures have been regrouped/reclassified, wherever necessary to confirm to current period's presentation.

Place: Mumbai

Date: 12 August 2024

Sudhir Mehta Managing Director DIN: 02215452



SANMIT INFRA LIMITED CIN: L70109MH2000PLC288648

Regd. Office: 601,MAKHIJA ROYALE, 6TH FLOOR, S.V. ROAD, Khar (W) Mumbai MH 400052 IN email: sanmitinfra@gmail.com; info@sanmitinfraltd.com, website; www.sanmitinfraltd.com UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30th JUNE 2024

Quarter

Ended

PARTICULARS	30.06.2024	30.06.2023	31.03.2024	31.03.2024
Total income from operations (net)	2,311.39	3,356.18	2,248.36	9,664.84
Net Profit / (Loss) from ordinary activities before tax	7.16	69.49	58.72	605.95
Net Profit / (Loss) from ordinary activities after tax	5.19	51.88	53.70	446.69
Net Profit / (Loss) for the period before tax (after Extraordinary items)	7.16	89.49	58.72	605.95
Net Profit / (Loss) for the period after tax (after Extraordinary forms)	5.19	51.88	53.70	446.69
Paid up Equity Share Capital (Face Value Rs. 1/- per Equity Share)	1,580.08	1,580.08	1,580.08	1,580.06
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	14	-		1,987.15
Earnings Per Share (before extraordinary items) (of Rs. 1/- each)				
Basic :	0.00	0.03	0.03	0.28
Dikated:	0.00	0.03	0.03	0.28
Earnings Per Share (after extraordinary items) of Rs. 1/- each)				
Basic :	0.00	0.03	0.03	0.28
and the second s	0.00	0.03	0.03	0.28

Previous year/period figures have been regrouped/reclassified wherever necessary. 2) The above results have been reviewed by the Audit Committee and have been approved by the

Board of Directors at their respective meeting held on 13th August, 2024. For Sanmit Infra Limited

Sanjay Makhija Managing Director Place: Mumbai Date: 13th August, 2024 DIN: 00586770

**RELIANCE CHEMOTEX INDUSTRIES LIMITED** 

Chemotex Industries Limited ("the Company") is being held through VC / DAVM.

(Formerly Known as Anshuni Commercials Limited)

Registered Office: Village Kanpur, Post Box No.73, Udaipur, Rajasthan, 313003

CIN: L40102RJ1977PLC001994

DADTICIII ADD

Tel: +91 (0) 294 2491489; +91 (0) 294 2491490 | Fax: +91 (0) 294 2490067 | E-mail: cs@reliancechemotex.com | Website: www.reliancechemotex.com NOTICE OF 46"ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING INFORMATION

In compliance with the applicable provisions of the Companies Act, 2013 ("the Act") rules made thereunder and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("the Listing Regulations") read with General Circular No. 14/2020 dated April 08, 2020, General Circular No. 17/2020 dated April 13,2020, General Circular No. 20/2020 dated May 05, 2020, General Circular No. 02/2021 dated January 13, 2021, General Circular No. 19/2021 dated December 08, 2021, General Circular No. 21/2021 dated December 14, 2021, General Circular No.02/2022 dated May 05, 2022, General Circular No.10/2022 dated December 28, 2022 and General Circular No. 09/2023 dated September 25, 2023 issued by Ministry of Corporate Affairs ("MCA Circulars") and Circular no. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020, Circular no. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021, Circular No. SEBI/HO/DDHS/DDHS Div2/P/CIR/2021/697 dated December 22, 2021, Circular no. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022, Circular no. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated January 05, 2023 and Circular no. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 dated October 7, 2023 issued by Securities and Exchange Board of India ("SEBI Circulars") permitted the holding of the Annual General Meeting ("AGM") through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM"), without the physical presence of the Members at a common venue, in

Notice is hereby given that the 46th AGM of the Company will be held on Wednesday, September 11, 2024, at 11:00 A.M. (IST) through VC/OAVM to transact the business, as set out in the Notice of AGM. In this connection, the Shareholders may note the following:

compliance with the provisions of the Act, the Listing Regulations, MCA Circulars and SEBI Circulars, the 46th AGM of Reliance

 Notice of 46th AGM along with the Annual Report for the financial year 2023-24 ("the Annual Report") has been sent electronically to those members whose e-mail addresses are registered with the Registrar & Share Transfer Agent ("Registrar") / Depository Participants ("DPs") and that physical copy of the Notice of AGM and the Annual Report will not be sent separately to any The Notice of AGM and the Annual Report covering all relevant statutory documents are available on the website of the Company at

www.reliancechemotex.com and on the website of NSDL at www.evoting.nsdl.com. The Notice of AGM is also available on the website of Stock Exchanges i.e. at www.nseindia.com and www.bseindia.com. The relevant documents referred to in the AGM Notice shall also be made available for inspection by the Members electronically based on requests received at shareholders@reliancechemotex.com. Additionally, such documents shall made available for inspection at the registered office of the Company during business hours on all working days except Saturdays and Sundays upto the date of the 46th AGM. Members can attend and participate in the AGM only through the VC/DAVM facility, the details of which are provided by the

Company in the Notice of the AGM. Accordingly, no provision has been made to enable shareholders to attend and participate in the 46th AGM of the Company in person. Members attending the meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum under section 103 of the Act.

Book Closure and Dividend: The Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Thursday, September 05, 2024 to Wednesday, September 11, 2024 (both days inclusive) for the purposes of holding 46th AGM and payment of dividend. The Record Date for the purposes will be Wednesday, September 04, 2024. If a dividend on Equity Shares, as recommended by the Board, is approved at the AGM, the payment of such dividend will be made within 30 days from the date of AGM, as under:

To all beneficial owners in respect of Shares held in electronic form as per details furnished by the Depositories for this purpose as of the close of business hours on September 04, 2024. ii. To all Members in respect of Shares held in physical form, after giving effect to valid, transmission or transposition requests

lodged with the Company as of the close of business hours on September 04, 2024. The Dividend will be paid electronically through online modes to those shareholders who have updated their bank account details

with the Company's Registrar i.e. Bigshare Services Private Limited | DPs. For Shareholders, who have not updated their bank account details, Dividend Warrants/ Demand Drafts will be sent to their registered addresses. To avoid delay in receiving the Dividend, the Shareholders are requested to update their bank / other relevant details with the

Registrar of the Company/ DPs as applicable. E-Voting Instructions:

1. Shareholders will be provided with the facility to cast their votes on all resolutions set forth in the Notice of AGM using the electronic voting system (e-voting) facility provided by NSDL, which is detailed in the Notice of AGM.

A person whose name is recorded in the register of members as on September 04, 2024 ("Cut-off Date") shall only be entitled to vote through remote e-voting. Voting rights shall be in proportion to the Equity Shares held by the Members as on Wednesday, III. Remote e-voting will commence at 9:00 A.M. (IST) on Saturday, September 7, 2024 and end at 5:00 P.M. (IST) on Tuesday,

September 10, 2024. During this period, Members holding shares either in physical or dematerialised form as on Cut-off Date may cast their votes electronically. The remote e-voting module shall be disabled by NSDL for voting thereafter. IV. Those Shareholders, who will be present in the AGM through VC/OAVM facility and who have not cast their votes on the

Resolutions through remote e-voting, shall be eligible to vote through remote e-voting system during the AGM. Shareholders who have cast their votes by remote e-voting prior to AGM may also attend / participate in the AGM through VC/OAVM, but shall not be entitled to cast their votes again. The Board of Directors of the Company has appointed Mr. Rahul Sharma (FCS: 9611, CP. no.: 18440) proprietor of Rahul S &

Associates, Practicing Company Secretaries, Jaipur, as the Scrutinizer for conducting the voting process in a fair and transparent Pursuant to the Finance Act, 2020, dividend income will be taxable in the hands of the shareholders w.e.f. April 1, 2020, and the

Company is required to deduct tax at source ("TDS") from dividends paid to shareholders at prescribed rates governed under the Income Tax Act, 1961 ("the IT Act"). In general, to enable Compliance with TDS requirements, Members are requested to complete and/or update their Residential status, PAN, Category as per the IT Act with their DPs or in case shares are held in physical form, with the Company (Registrar, by sending documents through email (tds@bigshareonline.com) on or before August 26, 2024. Any person who becomes a shareholder of the company after dispatch of the Notice and holding shares as of the cut-off date may

download the notice from the websites and follow the procedure for remote e-voting /attending the AGM through VC/e-voting at the AGM as mentioned in the notice. In case of any queries, you may refer to the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for

Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on 022 - 4886 7000 or send a request to Ms. Pallavi Mhatre, Manager, NSDL, 4th Floor, 'A Wing', Trade World, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai 400013, at evoting@nsdl.co.in

For Reliance Chemotex Industries Limited

Company Secretary & Compliance Officer

**Utkarsh Gaur** 

Membership No.: A60237



#### Lahoti Overseas Limited CIN: L74999MH1995PLC087643 Regd Off: 307, Arun Chambers, Tardeo Road. Mumbai - 400034. Tel. No. +91-22-40500100 Website: www.lahotioverseas.com E-mail: investor@lahotioverseas.com

(Rs. In Lakhs) STANDALONE CONSOLIDATED Corresponding 3 | Corresponding 3 Corresponding 3 3 Months 3 Months Preceding 3 Particulars Months Ended In Months Ended In Months Ended In Months Ended Ended Ended The Previous Year The Previous Year | The Previous Year 30.06.2024 31.03.2024 | 30.06.2023 | 30.06.2024 | 31.03.2024 | 30.06.2023 Total income from operations 11,969.32 10,162.38 12,155.65 11,969.32 10,162.38 12,155.65 Net Profit / (Loss) for the period (before Tax 385.68 36.57 369.76 392.50 42.51 378.23 Exceptional and/or Extra Extraordinary items\*) Net Profit / (Loss) for the period (before Tax after 385.68 36.57 369.76 392.50 42.51 378.23 Exceptional and/or Extra Extraordinary items\*) Net Profit / (Loss) for the period after Tax (after 453.78 (91.82)301.40 459.07 (88.46)308.55 Exceptional and/or Extra Extraordinary items\*) Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and 536.21 (45.62)354.23 541.50 (42.26)361.38 Other Comprensive Income (after tax) Equity Share Capital 584.59 584.59 584.59 584.59 584.59. 584.59 Reserves (excluding Revaluation Reserve as shown in the unaudited Balance Sheet of previous year) Earnings Per Share (of '2/-each) (for containuing and discontinuing operations) 1.56 (0.31)1.03 1.57 (0.30)1.06 Diluted: 1.56 1.03 1.57 (0.31)

Place: Udaipur

Date: 13-08-2024

a) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange websites. (www.bseindia.com) and the listed entity (URL of the filing)

b) The impact on net profit (loss) total comprehnsive income or any other relevent financial item(s) due to charged(s) in accounting policies shall be disclosed by means of a footnote

#-Exceptional and/or Extraordinary items adjusted in the statement of profit and Loss in accordance with Ind\*AS Rule/AS Rule whichever is

For Lahoti Overseas Limited

**Umesh Lahoti** 

Date: 13.08.2024 Place: Mumbai

applicable.









Managing Director

Date: August 13, 2024

Place: Vadodara

website www.bseindia.com and on the Company's website www.pbmpolytex.com

DIN: 00014247

financialexp.epapr.in

S.	PARTICULARS	Q	Year Ended		
No.		30-Jun-24 (Unaudited)	Kircher Charles Control of the Control	30-Jun-23 (Unaudited)	\$2000 (\$1000 Building)
a	Total Income from Operations	2,204.98	1,716.82		4,327.86
b	Profit Before Tax	291.40	(161.86)	(9.28)	769.64
C	Profit After Tax	158.14	(100.36)	(9.28)	653.36
d	Total Comprehensive Income for the period	158.86	(110.55)	(9.28)	643.17

The figures for the three months ended 31 March 2024 are the balancing figures between the audited figures in

The Income Tax Department ("the Department") conducted a Search activity ("the search") under section 132

not identified any adjustments to the current or prior period standalone financial results at this stage.

For and on behalf of the Board of Directors of Shraddha Prime Projects Limited

(Rs. In Lakhs except EPS)

Year Ended

31/3/2024

(Audited)

19,579.44

(859.89)

(859.89)

(645,33)

(609.44)

687.90

(9.38)

(9.38)

11,124.44

CONSOLIDATED

30/6/2023

Unaudited)

4,524.08

(322.77)

(322.77)

(238.02)

(250.55)

687.90

(3.46)

(3.46)

For and on behalf of Board of Directors

PBM Polytex Limited

Gopal Patodia

Managing Director

Quarter Ended

30/6/2024

4,161.65

(151.18)

(151.18)

(107.63)

(81.30)

687.90

(1.56)

(1.56)

31/3/2024

(Audited)

5.374.75

34.68

34.68

28.32

60.75

687.90

0.41

0.41